

આગળનો માર્ગ

એ ક્યારેય મંજૂર હોતું નથી: જાતિય હિંસા અને સતામણી રોકવાની કાર્યવાહીની યોજના દ્વારા (IT'S NEVER OKAY: AN ACTION PLAN TO STOP SEXUAL VIOLENCE AND HARASSMENT), દરેક વ્યક્તિ જાતિય હિંસા અને સતામણીની ધમકી, ડર કે અનુભવથી સુરક્ષિતપણે અને મુક્ત બનીને રહે એવું ઓન્ટેરિયો બનાવવા અમે અમારો ભાગ ભજવી રહ્યાં છીએ.

આ યોજનામાં નીચેના મુદ્દાઓ પ્રત્યે કટિબદ્ધતાઓ દેખાડવાનો સમાવેશ થાય છે:

- 1 કાર્યસ્થળે, કેમ્પસમાં, નિવાસી ક્ષેત્રોમાં અને દીવાની દાવાની પ્રક્રિયા મારફતે જાતિય હિંસા અને સતામણી સંબંધિત જોગવાઈઓ કડક બનાવતો ધારો ઘડી કાઢવો.
- 2 ગેરવર્તણૂકને પડકારવા, બળાત્કારી સાંસ્કૃતિક વર્તણૂકમાં ત્વરિત ફેરફાર લાવવાને પ્રોત્સાહિત કરવા અને લાંબા-સમય સુધી પેઢીના સ્વભાવને સહજભર્યું વલણ અને વર્તણૂકનો અંત લાવવા પ્રોત્સાહિત કરવા સમગ્ર ઓન્ટેરિયોમાં જાહેર શિક્ષણ અને જાગરૂકતા ઝુંબેશ ચલાવવી.
- 3 વધુને વધુ બચી જતા લોકો જાતિય અત્યાચારોને નોંધાવે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવા કાયદો લાગુ કરતા સત્તાવાળાઓ દયાળુ અને સંવેદનશીલ પ્રતિભાવને સહાયતા કરે તેવા સાધનો વિકસાવવા અને શ્રેષ્ઠ વ્યવહારો ઓળખી કાઢવા.
- 4 બચી જતા લોકોનો ફોજદારી ન્યાય તંત્રનો રસ્તો શોધવાનો અનુભવ સુધારવા સહાયતા વધારવી અને સુધારેલું ફરિયાદી મોડેલ વિકસાવવું.
- 5 ગ્રેડ્સ 1-12નાં વિદ્યાર્થીઓ આરોગ્યપ્રદ સંબંધો અને સંમતિ દર્શાવવા સહિતના શ્રેણીબદ્ધ મહત્વના મુદ્દાઓ અંગે ગહન સમજ મેળવે તે માટે તેઓનો આરોગ્ય અને શારીરિક શિક્ષણનો અભ્યાસક્રમ અદ્યતન બનાવવો.
- 6 કોલેજો અને યુનિવર્સિટીઓ સમગ્ર કેમ્પસમાં તાલીમ, રોકથામ, ફરિયાદી કાર્યપદ્ધતિઓ અને જવાબી પ્રોટોકોલ સમાવતી જાતિય હિંસા અને સતામણી કાર્યનીતિઓને સ્વીકારવા, વિદ્યાર્થીઓ સાથે મળીને કાર્યરત થાય તેવું અનિવાર્ય બનાવવા ધારો ઘડવો.
- 7 ઉત્કૃષ્ટ, યોગ્ય અને સમયસર સંભાળ માટે 24/7 પહોંચ સુલભ બનાવવા હોસ્પિટલ સ્થિત જાતિય અને ઘરેલું હિંસા સારવાર કેન્દ્રો દ્વારા પૂરી પડતી સહાયતા સુદૃઢ બનાવવી.
- 8 આરોગ્ય, સામુદાયિક સેવાઓ, શિક્ષણ અને ન્યાય ક્ષેત્રોના મોખરાના કાર્યકરો માટે અદ્યતન તાલીમ વિકસાવવી જેથી જાતિય અત્યાચાર અને સતામણીથી બચનારા લોકોને વધારે સારી સહાયતા કરી શકાય અને આતિથ્ય (હોસ્પિટાલિટી) ક્ષેત્રમાં કાર્યકરો માટે તાલીમ વિકસાવવી જેથી જ્યારે તેઓ ઉચ્ચ-જોખમી પરિસ્થિતિઓનો સામનો કરે ત્યારે તેઓને મદદરૂપ થઈને જાણકારી વધારવામાં સમર્થ બનાવી શકાય.

(આગળના પાન પર ચાલુ)

9

સામુદાયિક જાતિય અત્યાચાર કેન્દ્રો માટેનું ભંડોળ સ્થિર બનાવવું અને વધારવું.

IO

જાતિય અત્યાચારથી બચેલા લોકો જેઓના કેસો ફોજદારી સુનાવણી તરફ આગળ વધી રહ્યાં હોય તેઓને મફતમાં સ્વતંત્ર કાનૂની સલાહ પૂરી પાડવા પાઇલોટ કાર્યક્રમ ઘડી કાઢવો.

II

મહિલાઓ વિરોધી હિંસાના મુદ્દાઓ પર ઓન્ટેરિયોને કેનેડામાં આગેવાન બનાવવા કાયમી સમિતિની રચના કરવી.

I2

જાતિય સતામણી અંગે વધારે સુદૃઢ કાર્યનીતિઓ વિકસાવવામાં નિયોક્તાઓને મદદરૂપ થવા આચારસંહિતા અમલી બનાવવા સહિત, વ્યવસાયલક્ષી આરોગ્ય અને સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યસ્થળના કાયદાઓ વધારે સુદૃઢ બનાવવા તેમાં સુધારાઓ કરવા.

I3

સંમતિ, બળાત્કારી સંસ્કૃતિ અને લિંગ અસમાનતાના મુદ્દાઓ પર વાતચીત અને સંવાદ જાગૃત કરે તેવી યોજનાઓ વિકસાવવા ઓન્ટેરિયોના કલાકારોને ટેકો આપતું રચનાત્મક પ્રવૃત્તિ ભંડોળ શરૂ કરવું.



મદદ મેળવવા, 211 નંબર પર ફોન કરો કે વેબસાઇટની મુલાકાત લો: 211.CA
વધુ માહિતી માટે, વેબસાઇટ જુઓ: ONTARIO.CA\ITSNEVEROKAY